

## સ્કોલરશીપ અંગેની નોટિસ વર્ષ 2021-22

આથી શિષ્યવૃત્તિ નો લાભ મેળવતા ઓબીસી / એસ.સી / એસ.ટી કેટેગરીમાં આવતા હોય તેવા વિદ્યાર્થી ભાઈ-બહેનોને જણાવવાનું કે સ્કોલરશીપના ફોર્મ નું વિતરણ તારીખ 18-10-2021 ને સોમવાર ના રોજ ઓફિસ કાર્યાલયમાંથી સવારે 10:30 થી 12:30 દરમિયાન કરવામાં આવશે. ફોર્મ ઓફિસ કાર્યાલયમાંથી મેળવી ફોર્મ પાછળ આપેલ ડોક્યુમેન્ટ ને જે ક્રમ આપેલ છે તે ક્રમમાં જોડી દરેક ડોક્યુમેન્ટ મા વિદ્યાર્થીઓએ સહી કરીને ફોર્મ ઓફિસ કાર્યાલયમાં જમા કરાવવાનું રહેશે. ફોર્મ જમા કરવાનો સમય સવારે 10:30 થી 01:00 નો રહેશે. બપોર બાદ કોઈ ફોર્મ વિતરણ કે સ્વીકારવામાં આવશે નહિ..ફોર્મ વિતરણ અને જમા કરવાની છેલ્લી તારીખ 30-10-2021 ને શનિવાર સુધીની રહેશે... આ સ્કોલરશીપ ના ફોર્મ વિદ્યાર્થીઓના સગવડતા ભાગ રૂપે અમો આ ફોર્મ વિદ્યાર્થીઓને ભરી આપીએ છીએ જેમા કોલેજ ની કોઈ જવાબદારી રહેશે નહિ..

નીચે જણાવેલ ક્રમમાં જ ડોક્યુમેન્ટ ફોર્મ સાથે ફરજિયાત જોડવાના રહેશે

(ઝેરોક્ષ ઓફિસ કાર્યાલયમાંથી કાઢી આપવામાં આવશે નહિ)

1. આધારકાર્ડ ની સ્વ-પ્રમાણિત કરેલ નકલ - ૧
2. જાતિ અંગેના દાખલા ની નકલ - ૧
3. આવક અંગેના દાખલા ની નકલ - ૧ (૦૧-૦૪-૨૦૧૯ પછીનો જ માન્ય રહેશે)
4. બેન્ક પાસબુક ની નકલ - ૧
5. ધોરણ-૧૦ ના માર્કશીટ ની સ્વ-પ્રમાણિત કરેલ નકલ - ૧
6. ધોરણ - ૧૨ ના માર્કશીટ ની સ્વ-પ્રમાણિત કરેલ નકલ - ૧
7. શાળા છોડયાના પ્રમાણપત્ર ની સ્વ-પ્રમાણિત કરેલ નકલ - ૧
8. જો અભ્યાસમાં ગેપ પડેલ હોય તો અભ્યાસ માં તૂટ પડેલ અંગેનું ૨૦ રૂ. ના સ્ટેમ્પ પર સોગનદનામું વિદ્યાર્થીએ કરાવવાનું રહેશે.
9. પિતા હયાત ન હોય તો માતાના નામનો આવકનો દાખલો. (પિતાનું ડેથ સર્ટિફિકેટ ફરજિયાત જોડવું)
10. કોલેજમાં ભરેલ ફી પહોંચ ની નકલ - ૧
11. સેમ ૩ અને ૫ વાળા વિદ્યાર્થીઓએ આઈ-કાર્ડ સ્વ-પ્રમાણિત કરેલ નકલ - ૧
12. આ શિષ્યવૃત્તિ નું ફોર્મ વિદ્યાર્થીઓની સગવડતા ના ભાગ રૂપે કોલેજ માંથી ભરી આપવામાં આવે છે જેમાં કોલેજ કોઈ રીતે જવાબદાર રહેશે નહિ...
13. શિષ્યવૃત્તિ નું ફોર્મ ઓનલાઈન ભરવા માટે મોબાઈલ નંબર અગાઉ આપેલ હોય તેજ મોબાઈલ નંબર પર રજીસ્ટ્રેશન કરવામાં આવશે જો મોબાઈલ નંબર બંધ થઈ ગયેલ હોય તો મોબાઈલ નંબર બદલાવવા માટે તમારે સુરેન્દ્રનગર જવું પડશે..
14. જે વિદ્યાર્થીનું બેન્ક ખાતું દેના બેન્ક અથવા સિલ્હિકેટ બેન્ક ખાતામાં છે તેવા વિદ્યાર્થીઓના ખાતા વાળી બેન્ક બીજી અન્ય બેન્ક મા મર્જ થઈ હોવાથી તેવા વિદ્યાર્થીઓએ નવી બેન્ક પાસબુક અથવા નવો જે ખાતા નંબર આપેલ છે તે ખાતા નંબર અને આઈ.એફ.સી કોડ ફોર્મમાં લખવો..
15. વિદ્યાર્થીએ ફી રૂપિયા 130 છૂટા લાવવાના રહેશે.. ફોર્મ ભરવા માટે સવારે 10:30 થી 01:00 દરમિયાન જ આવવું બપોર બાદ ફોર્મ વિતરણ કે સ્વીકારવામાં આવશે નહિ.
16. ફોર્મ વિતરણ કરવાની અને ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ 30-10-2021 ની રહેશે..